

India condoles the untimely demise of former Prime Minister of Japan, H.E. Mr. Abe Shinzo

ભારત જાપાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન મહામહિમ શ્રીમાન અબે શિન્ઝોનાં અકાળ નિધન પર શોક વ્યક્ત કરે છે

08 જુલાઈ, 2022

ભારતની સરકાર અને લોકો જાપાનનાં ભૂતપૂર્વ વડાપ્રધાન મહામહિમ શ્રીમાન અબે શિન્ઝોનાં અકાળ નિધનથી અત્યંત દુઃખી છે અને તેઓનાં પરિવાર અને મતિરો તેમજ જાપાનનાં લોકોને અંતઃકરણપૂર્વક સાંત્વના પાઠવે છે.

શ્રીમાન અબે સ્વપ્નદ્રષ્ટા નેતા અને મુત્સદ્દી હતા, જેઓએ માનવતાની સુખાકારી માટે અથાગ કામ કર્યું હતું. તેઓએ સમગ્ર વશિવનાં લોકોનાં હૃદય અને મનમાં કાયમી છાપ છોડી હતી.

વડાપ્રધાન તરીકે ઓગસ્ટ 2007 માં તેઓની ભારતની મુલાકાત દરમિયાન, શ્રીમાન અબે દ્વારા ભારતીય સંસદમાં તેઓનું "બે સમુદ્રોનો સંગમ" ભાષણ આપવામાં આવ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે ભારત-જાપાન સંબંધ વશિવમાં કોઈપણ સ્થળે દ્વિપક્ષીય સંબંધનાં વક્રાસની સૌથી મોટી સંભાવના સાથે આશરિવાદ સમાન છે. તેઓનાં પ્રયાસો મુક્ત, ઓપન અને સમાવેશક ઈન્ડો-પેસિફિકને સાકાર કરવા આપણા રાષ્ટ્રોને સાથે લાવવામાં અતિ મહત્વપૂર્ણ રહ્યા છે.

શ્રીમાન અબેનાં વધુલ યોગદાનોએ ભારત-જાપાન સંબંધને વશિષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનાં સ્તર સુધી ઉપર ઉઠાવ્યા છે. જાપાનનાં વડાપ્રધાન તરીકેનાં તેઓનાં કાર્યકાળ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે મોટી સંખ્યામાં સીમાચિહ્ન સમાન પરિયોજનાઓ ચાલું કરવામાં આવી હતી. શ્રીમાન અબેને ભારતનો દ્વનિયિ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વભિષણ એનાયત કરવો ભારતમાં તેઓને મળેલ આદર અને સૂનેહની સાક્ષી પૂરે છે.

શ્રીમાન અબેએ 2022 માં જાપાન ઈન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ લીગ (JIPFL) અને જાપાન ઈન્ડિયા એસોસિએશન (JIA) એમ બન્નેની આગેવાની લેવી એ ભારત-જાપાન ભાગીદારીને વેગ આપવાની તેઓની ગહન કટબિદ્ધતાને પ્રતિપાદિત કરે છે.

ભારતનાં ઉત્તમ મીત્રની ખોટ આપણા સમગ્ર રાષ્ટ્રમાં વરતાઈ છે. આજે, સમગ્ર ભારત જાપાન સાથે શોક વ્યક્ત કરે છે અને આ મુશ્કેલ ક્ષણોમાં આપણે આપણા જાપાનીઝ ભાઈઓ અને બહેનો સાથે અખંડનિતા સાથે ઉભા છીએ. ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો અબે પ્રત્યે આપણા ગહન આદરનાં પ્રતિકિ સૂવરૂપે, 9 જુલાઈ 2022 નાં રોજ એક દવિસીય રાષ્ટ્રિય શોક પાળવામાં આવશે.

નવી દિલ્હી

08 જુલાઈ, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.